

લિક્વિડ ETF ની પસંદગી પહેલાં રોકાણકારોએ શું જાણવું જોઈએ ભારતીય રોકાણકારો માટે કેશ પાર્કિંગ ટૂલ તરીકે લિક્વિડ ETF નું ચલણ વધ્યું

ભાસ્કર ન્યૂઝ | અમદાવાદ

નાના ઓપ્ટિમાઇઝેશનથી વધુ સારું રિટર્ન મેળવી શકાય

ભારતીય રોકાણકારો માટે કેશ પાર્કિંગ ટૂલ તરીકે લિક્વિડ ETF નું ચલણ વધી રહ્યું છે, ત્યારે બજારમાં પ્રોડક્ટ ઈનોવેશન અને સ્પર્ધામાં વધારો જોવા મળી રહ્યો છે. ઓવરનાઈટ રેટ અનુસાર વળતર ઉત્પન્ન કરવાનો હેતુ ધરાવતા આ ફંડ રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોમાં લોકપ્રિય બન્યા છે, જે તેમની લિક્વિડિટી, સલામતી અને કરવેરાની વ્યવસ્થાને આભારી છે. જો કે, બધા લિક્વિડ ETF સમાન રીતે ડિઝાઇન કરવામાં નથી આવતા અને તાજેતરના લોન્ચમાં નવા, વધુ કાર્યક્ષમ માળખા રજૂ કરવામાં આવ્યા છે, જે વધુ ધ્યાન આપવા યોગ્ય હોઈ શકે છે.

પરંપરાગત રીતે, ભારતમાં

જૂન 2025માં તાજેતરના 6-દિવસની વિન્ડોમાં, એન્જલ વન નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF - ઓથે વાર્ષિક વળતર આપ્યું છે, જે રૂપિયા 100ની ફેસ વેલ્યુવાળા અન્ય ઓથ NAV આધારિત ETF કરતા 80-90 બેસિસ પોઇન્ટ વધારે હતું. કોઈ એક કદ તમામ માટે ફિટ હોય એવું નથી, પરંતુ પારદર્શિતા, સરળતા અને ઓછો ખર્ચ ઈચ્છતા રોકાણકારો નવી પેઢીના લિક્વિડ ETFમાંથી વધુ લાભ મેળવી શકે છે, જ્યાં નાના ઓપ્ટિમાઇઝેશનથી વાસ્તવિક દુનિયામાં વધુ સારા વળતર મળી શકે છે.

લિક્વિડ ઈટીએફ ડિવિડન્ડના મોડેલને અનુસરે છે, જેના કારણે જટિલ પર્ફોમન્સ ટ્રેકિંગ અને દૈનિક ટીડીએસ કપાત થાય છે, જે ચક્રવૃદ્ધિને અસર કરે છે. ઓથ NAV સ્ટ્રક્ચર, NAVમાં જ વળતર એકત્રિત કરે છે, સરળ ટ્રેકિંગ અને કર પછીની વધુ સારી કાર્યક્ષમતા પ્રદાન કરે છે, ખાસ કરીને ટૂંકા ગાળાના રોકાણકારો માટે. આવું જ એક ઈનોવેશન છે એન્જલ વન

નિફ્ટી 1D રેટ લિક્વિડ ઈટીએફ - ઓથ, જે આ ઓથ NAV મોડેલને અનુસરે છે અને NSE પર લિસ્ટેડ છે. લિક્વિડ ETFના પર્ફોમન્સમાં ટ્રેડિંગની કાર્યક્ષમતા મુખ્ય ભૂમિકા ભજવે છે. કેટલાક ETF રૂપિયા 100ની ફેસ વેલ્યુ પર ઓપરેટ કરે છે, પરંતુ એન્જલ વન નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF - ઓથ ₹0.01ની ચુસ્ત કિંમત સાથે ₹1,000ની ફેસ વેલ્યુનો ઉપયોગ કરે છે.